

LL.B. Semester - 3 (CBCS) Examination
Nov/Dec. -2021 [NEW COURSE]
Principles of Taxation Law & GST(Core)

Time: 2:30 Hours

Marks: 70

Instructions:

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

પ્રશ્ન.૧	આવક એટલે શું? કુલ આવકમાં કઈ - કઈ આવકનો સમાવેશ થાય છે?	(૧૪)
	અથવા	
પ્રશ્ન.૧	આવકની ગણતરી વખતે ક્યાં-ક્યાં ખર્ચાઓ, રાહતો અને અપવાદો મજરે મળે છે?	
પ્રશ્ન.૨	પ્રત્યક્ષ અને પરોક્ષ કરવેરા વિશે આવકવેરા કાયદાની જોગવાઈઓ જણાવો.	(૧૪)
	અથવા	
પ્રશ્ન.૨	આવકવેરા સત્તાવાળા વિશે સવિસ્તાર ચર્ચા કરો.	
પ્રશ્ન.૩	લાંબાગાળાનો મૂડી નફો અને ટૂંકાગાળાનો મૂડી નફો સમજાવો.	(૧૪)
	અથવા	
પ્રશ્ન.૩	પૂરવઠાનો વ્યાપ સમજાવી માલ અને મિશ્ર પૂરવઠા વિશે સમજાવો.	
પ્રશ્ન.૪	GST ના સંદર્ભમાં માલ અને સેવાકરના પ્રકારોની ચર્ચા કરો.	(૧૪)
	અથવા	
પ્રશ્ન.૪	માલ અને સેવાકર અધિનિયમ અંતર્ગત નોંધણી વિગતવાર સમજાવો.	
પ્રશ્ન.૫	ટૂંકનોંધ લખો (કોઈ પણ બે)	(૧૪)
	(1) ઇ-કોર્મસ	
	(2) માલ અને સેવાકર અધિનિયમ હેઠળ જમાનોંધ અને ઉધારનોંધ	
	(3) આવકવેરા કાયદા નીચે આકારણી	
	(4) માલ અને સેવાકર અધિનિયમ હેઠળ વેરા ભરતિયું	

ENGLISH VERSION

Q.1	What is income? Which incomes are included while computations of income?	(14)
	<u>OR</u>	
Q.1	Which expences, relief and exceptions are deducted while computation of income?	
Q.2	Explain the provisions of direct and indirect taxes under income tax act.	(14)
	<u>OR</u>	
Q.2	Discuss in details about the income authorities in detail.	
Q.3	Explain long term capital gain and short term capital gain.	(14)
	<u>OR</u>	
Q.3	Explain scope of supply and goods and composite supply	
Q.4	Discuss the kinds of goods and service tax under GST.	(14)
	<u>OR</u>	
Q.4	Explain in details about the registration under goods and service tax.	
Q.5	Write Short Notes: (Any two)	(14)
	(1) E-Commerce.	
	(2) Credit note and debit note under GST	
	(3) Assessment under income tax act	
	(4) Tax invoice under GST	
